

સૂચના

અન્ય વિદ્યાશાખામાંથી વિનયન શાખામાં અનુસ્નાતક કક્ષાએ રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવવા માટે જે પ્રવેશવાચ્છુઓએ ગુજયુનિમાં અરજી કરેલી છે, તેઓને જણાવવાનું કે આ સંદર્ભે (બીજા કોર્સની પરીક્ષા તરીકે) સ્કીનિંગ ટેસ્ટનો કાર્યક્રમ નીચે પ્રમાણે છે.

સ્કીનિંગ ટેસ્ટની તારીખ - 9 જુલાઈ 2019 મંગળવાર

સ્કીનિંગ ટેસ્ટનો સમય - બપોરે 2 થી 3

સ્કીનિંગ ટેસ્ટ માટેનું સ્થળ - રૂમ નં. 4 થી 6 ભાષાસાહિત્યભવન,
ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ

તા.ક. (1) વિદ્યાશાખા પરિવર્તન કાર્યક્રમ (ફેકલ્ટી ચેંજ પ્રોગ્રામ) અન્તર્ગત અન્ય અન્ય વિદ્યાશાખામાંથી વિનયન શાખામાં અને વિનયન શાખામાં પણ એક વિષયમાંથી બીજા વિષયમાં અનુસ્નાતક કક્ષાએ રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવવા માટે જે પ્રવેશવાચ્છુ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેઓ દ્વારા જે તે સંબંધિત વિષયમાં પ્રવેશ ખાલી અને ઉપલબ્ધ બેઠકો ઉપર નિયમિત વિદ્યાર્થી તરીકે પ્રવેશ લેવા માટે આવેલી અરજીઓના અનુસંધાનમાં ઉપર જણાવેલ સમયે અને સ્થળે ઉપસ્થિત રહેવું ફરજિયાત છે.

(2) બેઠક વ્યવસ્થા ટેસ્ટના દિવસે એટલે કે તા. 9 જુલાઈ, 2019 ને મંગળવારે ભાષા-સાહિત્ય-ભવન, ગુજ.યુનિ.ના નોટિસ બોર્ડ ઉપર પ્રદર્શિત કરવામાં આવશે.

(3) આ માટે જે તે વિદ્યાર્થીએ પોતે પસંદ કરેલા વિષયના ગુજયુનિએ બી.એ. કક્ષાએ નિર્ધારિત કરેલા અભ્યાસક્રમમાંથી 20 ગુણનો વર્ણનાત્મક અને 30 ગુણનો બહુવિકલ્પીય હેતુલક્ષી (એમ.સી.ક્યૂ) - એમ કુલ પચાસ ગુણનો ટેસ્ટ લેવાશે.

(4) જે તે વિદ્યાર્થીએ ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ પ્રાપ્ત કરવાના રહે છે. આ ટેસ્ટમાં સફળ થનાર વિદ્યાર્થીઓને જે તે વિભાગમાં ઉપલબ્ધ બેઠકોના આધારે મેરિટ મુજબ પ્રવેશ આપી શકાશે.

(5) પ્રવેશપરીક્ષાના દિવસે પોતાનું ગમે તે ફોટો આઈડી (અસલ) સાથે રાખવું.

(6) પરીક્ષાના દિવસે દરેક વિદ્યાર્થીએ બપોરે 1.00 કલાકે ભાષાભવનના સભાખંડમાં ઉપસ્થિત રહેવું. અહીં તમારે એક ફોર્મ ભરવાનું છે. જે નીચે પ્રમાણે છે. તમે પ્રિન્ટ કરી ભરીને પણ સાથે લાવી શકો છે.

(7) ઉપર્યુક્ત ફોર્મની સાથે તેની સાથે નિમ્ન લિખિત દસ્તાવેજ જોડવાના છે, તેથી એમની ઝેરોક્ષ કોપી લઈને આવવું.

- ક. પાસપોર્ટ સાઈઝનો ફોટો નં. 1
- ખ. ધો. 10 ના ગુણપત્રકની સ્વપ્રમાણિત નકલ
- ગ. ધો. 12 ના ગુણપત્રકની સ્વપ્રમાણિત નકલ
- ઘ. સ્નાતક કે અનુસ્નાતક કક્ષાના ગુણપત્રકની નકલ
- ડ. સ્કૂલ લિવિંગ સર્ટી. ની ઝેરોક્ષ નકલ
- ચ. જાતિના પ્રમાણપત્રની નકલ (લાગૂ પડતું હોય, તો)
- છ. આધારકાર્ડની નકલ

પ્રેષક:-

મોબાઇલ નં:-

સંયોજકશ્રી,
ફેકલ્ટી ચેન્જ પ્રોગ્રામ,
ભાષા-સાહિત્ય ભવન,
ગુજરાત યુનિવર્સિટી,
અમદાવાદ-૦૯

તા:- / /૨૦૧૯

બાબત:-અન્ય વિદ્યાશાખામાંથી વિનયન વિદ્યાશાખામાં અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ આપવા અંગે.

સાહેબશ્રી,
ઉપર જણાવેલ વિષયના અનુસંધાને હું શ્રી/શ્રીમતી/કુ _____ ગુજરાત
યુનિવર્સિટીની વિનયન વિદ્યાશાખામાં અનુસ્નાતક કક્ષાએ _____ વિષયમાં નિયમિત (રેગ્યુલર)
વિદ્યાર્થી તરીકે સ્વેચ્છાએ પ્રવેશ મેળવવા ઇચ્છુક છું. આ પ્રવેશ માટે યુનિવર્સિટી દ્વારા નિયત કરાયેલ સ્કીનીંગ
ટેસ્ટ આપવા માટે હું તૈયાર છું. ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિયમાનુસાર _____ વિષયના
સંબંધિત વિભાગમાં ઉપલબ્ધ ખાલી સીટ ઉપર મેરીટ અનુસાર પ્રવેશ ફાળવાશે તો તે અમોને મંજૂર છે. આ
માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રવેશ, પ્રવેશ પરીક્ષા, પ્રવેશપાત્રતા ઇત્યાદિ સહિતના નિયત કરાયેલ તમામ
નિયમો મેં જાણ્યા-સમજ્યા છે અને તે મને બંધનકર્તા છે.
આ અગાઉ મેં પસાર કરેલ અભ્યાસક્રમની વિગતો નીચે મુજબ છે.

વર્ષ	અભ્યાસક્રમ	મુખ્ય વિષય	કુલ ગુણ	મેળવેલ ગુણ/ટકા	પ્રયત્ન	યુનિવર્સિટીનું નામ	નોંધ

આ સાથે મારી શૈક્ષણિક લાયકાતનાં તમામ પ્રમાણપત્રો/માર્કશીટ/આધારકાર્ડ ઇત્યાદિ સામેલ છે.

આપનો/ની વિશ્વાસુ

વિદ્યાર્થી/વિદ્યાર્થિની સહિ ---